



Bhakta Kavi Narsinh Mehta University
Govt. Polytechnic College Campus, Bhakta Kavi Narsinh Mehta University
Road, Khadiya, Junagadh
Ph.(0)0285-2904003
Website : <http://www.bknmu.edu.in> email : cebknmu@gmail.com

પરીપત્ર :-

વિષય :- યુ.જી./એલએલ.બી. સેમ. ૫ ની પરીક્ષામાં ઈન્ટર્નલ (થીયરી તેમજ પ્રાયોગીક) માર્ક્સની એન્ટ્રી શરૂ કરવા બાબત.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન સર્વે કોલેજોના માનનીય આચાર્યશ્રીઓને જણાવવાનું કે, ડીસેમ્બર-૨૦૨૦ દરમિયાન ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર યુ.જી. સેમ.- ૫ ની ઈન્ટર્નલ (થીયરી તેમજ પ્રાયોગીક) પરીક્ષાઓનાં માર્ક્સની એન્ટ્રી માટેની પ્રારંભ થવાની તારીખ તથા પૂર્ણ થવાની તારીખની વિગત નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

ક્રમ	પરીક્ષાનું નામ	એન્ટ્રી પ્રારંભ થવાની તારીખ	એન્ટ્રી પૂર્ણ થવાની તારીખ
૧	યુ.જી./એલએલ.બી. સેમ. ૫ (તમામ કોર્સ)	૧૧-૧૨-૨૦૨૦	૨૨-૧૨-૨૦૨૦

જે કોલેજ દ્વારા બાહ્ય પ્રાયોગીક પરીક્ષાના માર્ક્સ યુનિવર્સિટીમાં જમા કરાવવાના બાકી હોય તેવી તમામ

કોલેજે ફરજિયાતપણે તારીખ: ૧૬-૧૨-૨૦૨૦ સુધીમાં જમા કરાવવાના રહેશે.

ખાસ જણાવવાનું કે,

૧. ઉપર્યુક્ત છેલ્લી તારીખ બાદ કરવામાં આવતી એન્ટ્રી સોફ્ટવેર પ્રોગ્રામ સ્વીકારશે નહીં, જે ધ્યાને લેવા વિનંતિ છે.
૨. ઈન્ટર્નલ માર્ક્સની એન્ટ્રી પૂર્ણ થયા બાદ કોલેજ/કેન્દ્રએ ચેકલીસ્ટની પ્રિન્ટની ખરાઈ કરી લેવાની રહેશે, છેલ્લી તારીખ બાદ સુધારો કરી શકાશે નહીં. અને જો ભૂલ આવી હશે તો દંડાત્મક ફી ભરી સુધારો કરવાનો રહેશે જેની નોંધ લેવી.
૩. ઈન્ટર્નલ માર્ક્સના ચેકલીસ્ટ આચાર્યશ્રી તથા વિષય અધ્યાપકશ્રી દ્વારા તેને સર્ટીફાઈડ કરીને વિદ્યાર્થીના ધ્યાને જાણ અર્થે નોટીસ બોર્ડ પર મુકવાનું રહેશે.
૪. ઈન્ટર્નલ માર્ક્સની એન્ટ્રી પૂર્ણ થયા બાદ જો કોઈ ભૂલ હોય તો જરૂરી સુધારો કરી, ચેકલીસ્ટની પ્રિન્ટ કાઢી તેની ખરાઈ કરી તેમાં આચાર્યશ્રી તથા વિષય અધ્યાપકશ્રીએ સહી સિક્કા કરી તેને સર્ટીફાઈડ કરીને કોલેજનાં રેકોર્ડઉપર રાખવાની રહેશે. યુનિવર્સિટીને જરૂરી લાગશે તો મંગાવે ત્યારે તે નકલ પરીક્ષા વિભાગમાં જમા કરાવવાની રહેશે.
૫. યુનિવર્સિટી દ્વારા પરીણામ જાહેર થયા બાદ કોઈ પણ સંજોગોમાં ઈન્ટર્નલ માર્ક્સમાં યુનિવર્સિટી દ્વારા ફેરફાર કરી આપવામાં આવશે નહીં.
૬. ઈન્ટર્નલ માર્ક્સની એન્ટ્રી દરમિયાન કોલેજ ના User Name તથા Password અપાયેલ છે તેનો જ ઉપયોગ કરવો અને તે માહિતી લીક ન થાય તે અંગેની સંપૂર્ણ જવાબદારી આચાર્યશ્રીની રહેશે જે સવિનય વિદિત થાય.


ઉપર મુજબની જાણ કોલેજના શૈક્ષણિક/બિનશૈક્ષણિક કર્મચારીઓના ધ્યાન ઉપર મુકવા અને જરૂરી વ્યવસ્થા ગોઠવવા યોગ્ય કરશોજી.

નોંધ:

ઉપરોક્ત કામગીરી માટે નોવેલ કોરોના વાઇરસ COVID-19 અંગે સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ માસ્ક પહેરી (ફેસ કવર) તેમજ સામાજિક અંતર જાળવી ઉપરોક્ત કામગીરી કરવાની રહેશે.

ખાસ નોંધ:-

દરેક કોલેજે ઈન્ટર્નલ માર્ક્સની એન્ટ્રીકર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી કોલેજનાં નોટીસ બોર્ડ ઉપર ફરજિયાત લગાવવાની રહેશે જેથી કરી ને વિદ્યાર્થીઓને પોતાના માર્ક્સમાં કોઈ ભૂલ જણાય તો કોલેજનાં આચાર્યશ્રીનો સંપર્ક કરી શકે અને તેમાં સુધારો કોલેજ દ્વારા કરી લેવાનો રહેશે ત્યાર બાદ કોઈ સુધારો કરી આપવામાં આવશે નહીં જેની નોંધ લેવી.


પરીક્ષા નિયામક

નં :- બીકેએનએમયુ/પરીક્ષા/૧૩૬૩/૨૦૨૦
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,
ગવર્નમેન્ટ પોલીટેકનીક કેમ્પસ,
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ,
ખડિયા, જુનાગઢ-૩૬૨૨૬૩
તા. ૧૧/૧૨/૨૦૨૦

પ્રતિ,

યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ તેમજ વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો તરફ...

નકલ સવિનય રવાના:-

- (૧) માન.કુલપતિશ્રી/કુલસચિવશ્રીના અંગત સચિવશ્રી
- (૨) આઈ.ટી. સેલ (વેબસાઇટ પર પ્રસિધ્ધ થવા અર્થે.)